



CORONAVIRUS

રમજાન માટે ઘરમાં જ રહો

ગુરુવાર 23મી એપ્રિલ - શનિવાર 23મી મે 2020

ધર્મનાં સ્થાનો હાલના સમયમાં બંધ રહેશે

રમજાન દરમ્યાન ઘરમાં રહેવાથી કોરોનાવાઈરસ (કોવિડ-19)-નો ફેલાવો ધીમો કરવામાં દેશના પ્રયાસોમાં તમે અગત્યનો ફાળો આપી શકશો. સમગ્ર ઈંગ્લેન્ડમાં સમાજો જ્યારે આ પાક મહિનાની ઉજવણી માટે તૈયારી કરી રહ્યાં છે ત્યારે આરોગ્ય નિષ્ણાતો અને મુસ્લિમ આગેવાનોએ આ સંદેશો પાઠવ્યો છે.

ઘરમાં રહેવાની અને સામાજિક અંતર રાખવાનાં નિયમોની સરકારની હાલની માર્ગદર્શિકા યુ.કે.નાં તમામ નાગરિકોને લાગુ પડે છે અને તેને બ્રિટિશ બોર્ડ ઓફ સ્કોલર્સ એન્ડ ઈમામ્સ સહિતનાં તમામ પ્રકારનાં મુસ્લિમ સામાજિક સંસ્થાનો દ્વારા ટેકો આપવામાં આવેલ છે. સરકાર માને છે કે આ એક અત્યંત અસાધારણ વિનંતી છે, પરંતુ આ નિયમોનું પાલન કરવાથી કોરોનાવાઈરસના ફેલાવા પર કાબૂ રાખવામાં અને કુટુંબીજનો, મિત્રો, વ્યાપક સમાજ તેમજ ખાસ કરીને અત્યંત અરક્ષિત લોકોનું રક્ષણ કરવામાં મદદ મળશે.

તમારી જાતને અને તમારાં સ્વજનોને આ વર્ષે રમજાન દરમ્યાન સાજાં-નરવાં રાખવાં એટલે કે તમારાં સામાન્ય મજાહબી રીત-રિવાજોનું અનુસરણ કરવું, આ ખાસ કરીને આરોગ્યની કોઈ જૂની બીમારીને કારણે શિલ્ડોંગ કરી રહ્યાં અરક્ષિત લોકોનાં રક્ષણ માટે, તેમજ જેઓ અત્યંત અરક્ષિત હોય તે લોકોનાં કુટુંબીજનો, મિત્રો અને કેરરોનાં પણ રક્ષણ માટે અગત્યનું છે.

રમજાન દરમ્યાન તમારે આ ચારમાંથી કોઈ એક કારણસર જ તમારા ઘરમાંથી બહાર નીકળવું જોઈએ:

- પાયાની જીવન જરૂરિયાતની ચીજોની ખરીદી કરવી, દાખલા તરીકે ખોરાક અને દવાઓ, બને તેટલી ઓછી વાર
- દિવસમાં એક જ વાર કોઈ એક પ્રકારની કસરત કરવા દાખલા તરીકે, ચાલવા, દોડવા અથવા સાઈકલ ચલાવવા - એકલાં અથવા તમારા ઘરના કોઈ સભ્યની સાથે
- કોઈ તબીબી જરૂરિયાત માટે, રક્તદાન કરવા, ઈજા થવાનું જોખમ ટાળવા કે તેનાથી ભાગવા, સંભાળ પૂરી પાડવા અથવા કોઈ અરક્ષિત વ્યક્તિની મદદ કરવા
- કામ પર જવા, પરંતુ જો તમે ઘરેથી કામ ન કરી શકો તેમ હોય તો જ

પરંપરાગત રીતે રમજાન સાથે મળીને નમાજ પઢવાનો, આધ્યાત્મિક વાર્તાલાપો કરવાનો, કુટુંબીજનો, મિત્રો સાથે મળીને રોજા છોડવાનો અને ભોજન કરવાનો તેમજ છેલ્લે ઈંડ-ઉલ-ફિત્રની સાથે મળીને ઉજવણી કરવાનો સમય છે. આ આખાયે પાક મહિના દરમ્યાન ઘરમાં રહેવાનું મુશ્કેલ બનશે, પરંતુ NHSના રક્ષણ માટે અને જીવન બચાવવા માટે તે જરૂરી છે.



આ સમય દરમ્યાન તમે તમારાં કુટુંબીજનો, મિત્રો અને વિસ્તૃત મજાહબી સમુદાય સાથે સંપર્કમાં જોડાયેલાં રહેવા માટે તમે ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરી શકો તે વિચારો. વિડીયો અને સોશિયલ મેડીયાથી તમે નમાજની સેવાઓ અને કાર્યવિધિઓ સાથે સંપર્ક બનાવી શકો છો. વ્યક્તિગત મજાહબી નેતાઓ અને સંભાળની સેવાઓ ફોન મારફતે મેળવી શકાય છે. શારીરિક રીતે જુદાં હોવાં છતાં, મજાહબી વિધિઓ તમારા બાકીના મજાહબી સમુદાયની સાથે એક જ સમયે સાથે મળીને કરી શકાય છે. તમારા મજાહબી આગેવાનો તમને સંપર્કમાં જોડાયેલાં રહેવા માટેની ઘણી બધી રીતો વિશે સલાહ આપી શકશો.

તંદુરસ્ત લોકો માટે આ રમજાન દરમ્યાન સામાન્ય રીતે રોજા રાખી ચાલુ શકાય છે. જો તમને કોરોનાવાઈરસનાં ખૂબ જ હળવાં ચિહ્નો હોય અથવા ફુલુ જેવી બીમારી હોય અને તમારા ડોક્ટરની સલાહ મુજબ તમને કોઈ દવા કે સારવારની જરૂર ન હોય, તો તમે પણ રોજા રાખી શકો છો, પરંતુ તે તમારે સ્વ-એકાંતમાં (સેલ્ફ આઈસોલેશન)માં કરવું જોઈએ. બીજાં વધારે ગંભીર ચિહ્નો સાથેનાં કોરોનાવાઈરસ સાથેનાં દર્દીઓએ રોજા નહિ રાખવાનું વિચારવું જોઈએ, જેમ બીજી કોઈ પણ ગંભીર બીમારીવાળાં દર્દીઓ કરે છે તેમ જ. તમારી બીમારી અંગેના ખાસ સંજોગો વિશે અને તમારા માટે રોજા રાખવાનું સલાહકારક છે કે નહિ તે વિશે હંમેશાં તમારા ડોક્ટર સાથે સલાહ વાતચીત કરો. બીજાં લોકો માટે ઈંફ્ટર અને સુહૂર માટે ભોજન તૈયાર કરતાં લોકોને જો કોરોનાવાઈરસનાં કોઈ ચિહ્નો હોય અથવા ફુલુ જેવી બીમારી હોય, તો તે ન કરવું જોઈએ, ભલે પછી ચિહ્નો ગમે તેટલાં હળવાં હોય.



તમારું પોતાનું અને બીજાનું રક્ષણ કરવા માટે નમાજ કરતાં પહેલાં વુડુ કરવા ઉપરાંત, તમે જ્યારે તમારા ઘરમાં પાછાં આવો, નાક સાફ કરો અથવા ઉધરસ ખાવ, ખોરાક ખાવ કે ખોરાકને અડો ત્યારે પાણી અને સાબુ વડે 20 સેકંડ સુધી હાથ ધોઈને અથવા હેન્ડ સેન્ટાઇઝર વાપરીને તંદુરસ્તીમય સ્વચ્છતા પણ જાળવવી જોઈએ.



રમજાનનો મહિનો અલ્લાહની ઈબાદત, બીજાના હિતનો વિચાર કરવાનો, સ્વ-બલિદાનનો અને દાન-ધર્મનો સમય છે - આ બધાં જ ગુણો આ દેશવ્યાપી રોગચાળાનો સામનો કરવાનાં આપણાં સહિયારા પ્રયાસો માટે ખૂબ જ અગત્યનાં છે. આ રમજાનમાં, આપણો આપણાં કુટુંબીજનોમાં, આપણા આસ-પડોશમાં અને આપણા તમામ વિભિન્ન સમાજોમાં જે સૌથી અરક્ષિત લોકો છે તેમનું કેવી રીતે રક્ષણ કરી શકીએ તેનો વિચાર કરીએ. સાથે મળીને કામ કરવાથી આપણો કોરોનાવાઈરસ એકબીજાંમાં ફેલાતો ઓછો કરી શકીશું અને આપણી આરોગ્ય અને સંભાળની સેવાઓ પર પડતો ભારે બોજો ઓછો કરી શકીશું. આ દેશવ્યાપી રોગચાળો જે ઊડા આધ્યાત્મિક સંદેશા લઈને આવ્યો છે એ ન ભૂલીએ; એકતા, સાથે ભેગાં થાવ અને અલ્લાહની રહેમતથી કોઈને પણ એકલાં પાછળ ન મૂકો.



ઓસમાન દાર, પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડમાં ગ્લોબલ હેલ્થ વિભાગમાં કન્સલ્ટન્ટ

રમજાન માટે ઘરે જ રહો

- ખોરાક, આરોગ્યને લગતાં કારણો અથવા કામ માટે જ બહાર નીકળો (જો તમે ઘરેથી કામ કરી શકો તેમ ન હોય તો જ)
- જો તમે બહાર નીકળો તો દરેક સમયે લોકોથી 2 મીટર (6ફિટ) જેટલાં દૂર રહો
- ઘરે પહેંચીને તરત જ તમારા હાથ ધોઈ લો
- બીજાં લોકોને મળશો નહિ, મિત્રો અથવા કુટુંબીજનોને પણ નહિ. તમને પોતાને ચિહ્નો ન હોય તો પણ તમે વાઈરસ ફેલાવી શકો છો

જો તમે તબીબી રીતે અત્યંત અરક્ષિત હો તો તમારું રક્ષણ કરવા માટે દરેક સમયે ઘરમાં જ રહેવાની અને કોઈની સાથે રૂબરૂ સંપર્ક નહિ કરવાની સખત સલાહ છે.

જો તમને એવાં કોઈ ચિહ્નો હોય જે કદાચ કોરોનાવાઈરસને કારણે થયાં હોય અને હોસ્પિટલની સારવારની જરૂર ન હોય, અથવા તમે રહેતાં હો તે ઘરમાં બીજા કોઈને કોરોનાવાઈરસને કારણે કદાચ ચિહ્નો થયાં હોય, તો તમે સાજાં થઈ જાવ ત્યાં સુધી તમારે ઘરે રહેવું જ જોઈએ.

યુ.કે. સરકાર NHSનું રક્ષણ કરવા અને જીવનો બચાવવા કોરોનાવાઈરસની અસર ઘટાડવા માટે વૈજ્ઞાનિકો દ્વારા પૂરી પાડવામાં આવતી સલાહ અનુસારની કાર્ય યોજનાનું પાલન કરી રહી છે. આ યોજનાની સફળતાનો આધાર માર્ગદર્શિકાનું પાલન કરવામાં દેશનાં લોકો કેટલો ટેકો આપે છે તેના પર રહેલો છે. મહેરબાની કરીને આ માર્ગદર્શિકાનું પાલન કરો અને આ રમજાનમાં સલામત રહો.

